

July 27, 2022

Ref. No.: **AIL/SE/29/2022-23**

To,

BSE Limited

Phiroze Jeejeebhoy Towers,
Dalal Street, Fort,
Mumbai-400001, MH.

Scrip Code: **543534**

National Stock Exchange of India Limited

Exchange Plaza,
Bandra Kurla Complex, Bandra (E),
Mumbai-400051, MH.

Symbol: **AETHER**

Dear Madam / Sir,

Subject: Newspaper advertisement for Financial Results for the First Quarter ended on June 30, 2022

In accordance with Regulation 30 and Regulation 47 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015, the newspaper advertisement published in 'Gujarat Mitra' and 'Financial Express' for the standalone unaudited Financial Results for the First Quarter ended on June 30, 2022, are enclosed herewith.

We request you to kindly take the information on your records.

Thank you.

For Aether Industries Limited



Chitrarth Rajan Parghi
Company Secretary & Compliance Officer



Encl.: As enclosed

10k MSMEs shut between 2016 and 2022; 96% in 3 yrs

Credit and other schemes seen to soften the blow

SANDEEP SONI
New Delhi, July 26

AS MANY AS 10,067 MSMEs were shut between 2016 and 2022, with 96% of the closure in the three years to 2022, official data shows, confirming the ravaging impact the pandemic has had on the sector. Several policy steps to spur formalisation of the economy, including the measures to curb evasion of goods and services tax (GST), have also had a short-term adverse effect on the labour-intensive sector.

Ishita Ganguli Tripathy, additional development com-



missioner at ministry of MSME, told Financial Express Online: "Closure of MSMEs is certainly a concern for the government for which necessary steps and studies have been undertaken. Closure is one of the reasons cited by units for cancelling their MSME registrations, but the reason for closure is not always mentioned by them. Other reasons for cancelling registrations

include stopping the manufacturing of goods or moving to other businesses or they just don't need the registration anymore." In a written reply in the Rajya Sabha on Monday, minister of state for MSMEs Bhanu Pratap Singh Verma noted that while 400 MSMEs were shut during the 2016-2019 period, 9,667 were shut between 2019 and 2022.

On the Covid-19 impact on MSMEs, Verma said that 2,870 MSMEs registered on the Udyam portal were shut between April 1, 2022, and July 20, 2022, along with employment loss for 19,862 people. Similarly, 6,222 Udyam-registered MSMEs were shut in FY 22 with 42,662 people losing jobs.

CENTRAL RAILWAY MISCELLANEOUS WORKS

Notice for inviting tender regarding award of contract for collection & segregation of waste including loose cement and sweeping of commodity fallen in Goods shed premises and housekeeping of offices and conveniences as given in scope of work at New Mulund Goods Shed (NGSM) for a period of Three (03) Year have been uploaded on website www.ireps.gov.in. Tenderers are requested to visit the website www.ireps.gov.in to know the details of tenders. Tender No.: BB-C-130-WA-Goods-NGSM-22 Tender Closing Date Time: on 17.08.2022 at 15.00 Hrs. Further addendum/corrigendum, time extension, clarification etc. if any, in connection with the subject tender, will only be uploaded in the website. Bidders should regularly visit the website to keep themselves updated. Conditional offers will summarily be rejected.

RailMadad Helpline 139 342

S. E. RAILWAY - TENDER

Tender Notice No.: ST-CKP-OT-20-2022, dated 22.07.2022. e-Tenders are invited by Sr. Divisional Signal & Telecom Engineer/Co/Chakradharpur for and on behalf of the President of India against Tender No. ST-CKP-OT-20-2022-1,2,3,4,5,6,7 & 8 due to open on 16.08.2022 at 15.00 hrs., for the following works. Manual offers are not allowed against this tender and any such manual offer received shall be ignored. SI. No. & Name of Work; Tender Value; Earnest Money: (1) Interlocking of 03 Nos. of L.C. Gates i.e. RBK-42 between Maluka-Dangoosli, TB-1 & TB-7 between Tata-nagar-Haludpukur; ₹ 1,05,91,964.56; ₹ 2,03,000/-; (2) Placement of 1 No. Non-AC commercial Registered Vehicle TATA SUMO or better for DSTE/Jharsuguda; ₹ 10,38,257.52; ₹ 20,800/-; (3) S&T works for RUB in lieu of LC Gates No. 144, 147, 148 & 159 in Adityapur-Mahalimarup section; ₹ 27,56,091.42; ₹ 55,100/-; (4) Online Monitoring, Remote Diagnostic and Predictive Maintenance System of Railway Signalling Gears for 03 Stations i.e. Talaburu, Kendiposi, Maluka; ₹ 1,66,39,500/-; ₹ 2,33,200/-; (5) Alteration/Modification in EI/PI in connection with Elimination of Interlocked L.C. Gates at Kansbahal and Sonakhani Stations; ₹ 25,11,967.48; ₹ 50,200/-; (6) Alteration/Modification in EI/PI in connection with Elimination of Interlocked L.C. Gates at Dumetra, Chandiposi and Lathikaha Stations; ₹ 37,67,951.22; ₹ 75,400/-; (7) Alteration/Modification in EI/PI in connection with Elimination of Interlocked L.C. Gates at Jarakela Station; ₹ 12,55,983.74; ₹ 25,100/-; (8) Alteration/Modification in EI/PI in connection with Elimination of Interlocked L.C. Gates at Chakradharpur and Lotapahar Stations; ₹ 25,11,967.48; ₹ 50,200/-; Completion Period: 15 (Fifteen) Months for sl. nos. 1, 4, 5, 6, 7 & 8; 24 (Twenty Four) Months for sl. no. 2 and 12 (Twelve) Months for sl. no. 3. The tender details can be viewed at web site <http://www.ireps.gov.in>. The tenders/bidders must have Class-III Digital Signature Certificate & must be registered on IREPS portal. Only registered tenderer/bidders can participate in e-tendering. e-Tender Forms shall be issued free of cost. (PR-391)

CENTRAL RAILWAY

OPEN TENDER NOTICE No. 15-2022-NGP-SNT-AQWKS Date: 19.07.2022

Name of Work: Signaling work related to supply, installation, testing and commissioning of various engineering works at various LC gates and Bridges in Nagpur Sewagram section of Nagpur Division. Tender Cost: ₹ 66,09,447.74/- Earnest Money: ₹ 1,32,200/- Cost of Tender Booklet: ₹ 5,000/- Date & Time of Closing of Tender: 12.08.2022 at 15.00 hrs. Details on Railway's Website www.ireps.gov.in Sr. Div. Eng (S & T) Nagpur

RailMadad Helpline 139

CENTRAL RAILWAY

OPEN TENDER NOTICE No. 16-2022-NGP-SNT-ENGG-S Date: 19.07.2022

Name of Work: Signaling work for supply, installation, testing and commissioning of Engineering works related to closure of LC gate by providing Limited Height subway and Road over Bridge and TRR works at various locations in Sewagram - Ballarshah section of Nagpur Division. Tender Cost: ₹ 2,38,61,130.54/- Earnest Money: ₹ 2,69,300/- Cost of Tender Booklet: ₹ 5,000/- Date & Time of Closing of Tender: 12.08.2022 at 15.00 hrs. Details on Railway's Website www.ireps.gov.in Sr. Div. Eng (S & T) Nagpur

RailMadad Helpline 139

पंजाब नैशनल बैंक Punjab National Bank

Information Technology Division, HO, 5, Sansad Marg, New Delhi - 110 001 (Email ID: itdhw@pnb.co.in, Phone: 011-23311452)

TENDER NOTICE

Punjab National Bank invites online bids (both technical and commercial) from eligible bidders for RFP for Anti-Phishing, Anti Pharming, Anti Rogue Services along with Darknet Services. Interested bidders may visit our e-Procurement website <https://etender.pnbnbt.in> or <https://www.pnbindia.in> for downloading the detailed RFP document. The Bids are required to be submitted online using digital certificates (Signing & encryption) through our e-Procurement system. Last date for online bid preparation and hash submission is 23.08.2022 till 1600 hrs. and bid re-encryption & hard copy bid submission is 24.08.2022 till 1400 hrs. All future communications related to RFP will be uploaded on our websites <https://etender.pnbnbt.in> and <https://www.pnbindia.in>.

Asst. General Manager

PRIMA PLASTICS LIMITED

(CIN - L25206DD1993PLC001470)
Regd. Off: 98 / 4, Prima House, Daman Indl. Estate, Kadaiya, Nani Daman, Daman (Union Territory) - 396 210. Tel.: 0260 - 2220445 Fax: 0260 - 2221845 E-mail: investor@primoplastics.com Website: www.primoplastics.com

NOTICE OF 28th ANNUAL GENERAL MEETING & E-VOTING INFORMATION

Notice is hereby given that the 28th Annual General Meeting ("AGM") of the Members of Prima Plastics Limited ("the Company") will be held on **Wednesday, August 17, 2022 at 11.00 a.m. (IST)** through Video Conferencing ("VC")/Other Audio Visual Means ("OAVM") to transact the business set out in the notice of the AGM ("Notice") dated June 30, 2022.

The Annual Report of the Company for the financial year 2021-22 along with the Notice of the AGM has been sent on Monday, July 25, 2022 through electronic mode to the Members whose e-mail addresses are registered with the Registrar and Share Transfer Agent / Depository in accordance with the General Circular No. 02/2022 dated May 5, 2022, issued by the Ministry of Corporate Affairs ("MCA") and Circular No. SEBI/HO/CFD/CMD2/CI/P/2022/62 dated May 13, 2022, issued by the Securities and Exchange Board of India ("SEBI") (collectively referred to as "Circulars").

The Annual Report including the Notice of AGM is also available on the Company's website at https://www.primoplastics.com/pdf/annual_report/ppl-annual-report-2021-22.pdf, the website of the BSE Limited at www.bseindia.com and on the website of Central Depository Services (India) Limited ("CDSL") at www.evotingindia.com.

REMOTE E-VOTING / E-VOTING DURING THE AGM

Pursuant to the provisions of Section 108 and other applicable provisions, if any, of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company has engaged the services of CDSL to provide the facility to Members to exercise their right to vote on the resolutions proposed to be passed at the AGM through electronic voting system. The Members can cast their vote through remote e-voting before the AGM as well as during the AGM through e-voting. The Members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again.

The remote e-voting shall commence on **Saturday, August 13, 2022 from 9.00 a.m. (IST)** and shall end on **Tuesday, August 16, 2022 at 5:00 p.m. (IST)**. The remote e-voting module shall be disabled by CDSL thereafter upon expiry of the period. The voting rights shall be as per the number of equity shares held by Members as on **Wednesday, August 10, 2022**, being the cut-off date. Any person, whose name appears in the Register of Members as on the cut-off date is eligible to cast vote electronically on all the resolutions set forth in the Notice of AGM. Members attending the AGM through VC / OAVM, who have not cast their vote by remote e-voting, shall be eligible to vote during the AGM and for a period 15 minutes after the close of the AGM. Once the vote on a resolution is cast by the Member, he/she will not be allowed to change it subsequently.

Detailed procedure for e-voting and joining the Meeting through VC/OAVM is provided in the Notice of the AGM.

Any person who acquires shares of the Company and becomes member of the Company after the notice has been sent electronically by the Company, and holds shares as on the cut-off date, i.e. **Wednesday, August 10, 2022** may kindly refer to the notice uploaded in the Company's website at https://www.primoplastics.com/pdf/board_meeting/PPL--Notice-of-AGM--2022.pdf

In case of queries / grievances in respect of attending AGM through VC and voting by electronic means, Members may write to Mr. Rakesh Dalvi, Sr. Manager, Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futrex, Marfatil Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an email to: helpdesk.evoting@cdslindia.com or call on 022-23058542/43.

BOOK CLOSURE

Also, notice is hereby given that pursuant to Section 91 of the Companies Act, 2013 read with rules thereto, the Register of Members and Share Transfer Books of the Company will remain closed from **Thursday, August 11, 2022 to Wednesday, August 17, 2022 (both days inclusive)** for the purpose of AGM.

For Prima Plastics Limited
Sd/-
Vandana S. Ahuja
Company Secretary & Compliance Officer

Date: July 26, 2022
Place: Mumbai

GUJARAT INTERNATIONAL FINANCE TEC-CITY COMPANY LIMITED (GIFTCL)

E-Tender Notice for Invitation to Bid for Selection of Supplier

Gujarat International Finance Tec-City Company Limited invite bids from reputed, qualified, experienced and financially sound Supplier for the following Procurement:

Name of Procurement	Estimated Cost	Duration of Supply	End Date of Online Bid Submission	Last Date of Physical Bid Submission
Supply of Water Bowser with Boom Tower (BID Reference No.: GEM/2022/B/2346264)	Rs.3.85 Crore (inclusive of GST)	300 Days	25 th August 2022 up to 15:00 hrs	25 th August 2022 up to 15:00 hrs

Bid document may be downloaded online from website at <https://www.gem.gov.in>
For further details and updates please log on to our Website www.giftgujarat.in

Contact Person: Sd/- Managing Director & Group CEO
COO
Tel: 079-61708300 E-mail: contract@giftgujarat.in

Gujarat International Finance Tec-City Company Limited (GIFTCL)
EPS Building no. 49A, Block 49, Zone 04, Gyan Marg, GIFT City, Gujarat, INDIA. Pin-382355.
Tel.: +91 79 61708300, CIN:U75100GJ2007PLC051160

GARNET INTERNATIONAL LIMITED

CIN No.: L74110MH1995PLC093448
Regd. Off:- 901, Raheja Chambers, Free Press Journal Marg, Nariman Point Mumbai - 400021, Maharashtra Tel No.: 91-022-22820714; +91-22 22820715
Email ID: info@garnetint.com Website: www.garnetint.com

Unaudited Standalone and Consolidated Financial results for the quarter ended 30th June, 2022 (Rs. In Lacs)

Sr. No.	Particulars	Standalone			Consolidated					
		Quarter Ended		Year ended	Quarter Ended		Year ended			
		30.06.2022	31.03.2022	31.03.2022	30.06.2022	31.03.2022	31.03.2022			
1	Total Income from Operations	603.52	54.14	182.64	1,039.45	1,575.27	1,044.95	894.95	4,384.39	
2	Net Profit / (Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items)	93.70	(22.65)	(190.57)	(282.87)	162.63	28.66	(149.68)	(86.29)	
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	93.70	(22.65)	(190.57)	(282.87)	162.63	28.66	(149.68)	(86.29)	
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	93.70	(22.99)	(190.62)	(283.26)	162.63	(9.92)	(149.07)	(124.92)	
5	Total Comprehensive Income for the period [comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	93.97	(22.48)	(190.59)	(282.56)	162.89	(9.41)	(149.04)	(124.21)	
6	Equity Share Capital	1,963.50	1,963.50	1,963.50	1,963.50	1,963.50	1,963.50	1,963.50	1,963.50	
7	Reserves (excluding Revaluation Reserve) as shown in Audited Balance sheet of the previous year	-	-	-	506.03	-	-	-	1,093.62	
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)	a. Basic	0.48	(0.11)	(0.97)	(1.44)	0.83	(0.05)	(0.76)	(0.64)
	b. Diluted	0.48	(0.11)	(0.97)	(1.44)	0.83	(0.05)	(0.76)	(0.64)	

Note:- The above is an abstract of the detailed format of the Financial Results - As per IND AS Compliant filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and the Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial results are available on the Company's website www.garnetint.com and on the BSE website.

For Garnet International Limited
Suresh Gaggar
Chairman
DIN : 0059561

Place : Mumbai
Dated : 25th July, 2022

इंडियन बैंक Indian Bank

इलाहाबाद ALLAHABAD
CBD BELAPUR BRANCH: Shop No. 9, 10 & 11, Balaji Bhavan, Sector 11, CBD Belapur, Navi Mumbai - 400 614.

SALE NOTICE FOR SALE OF IMMovable PROPERTIES

E-auction Sale notice for sale of immovable Assets under the Securitisation and Reconstruction of financial Assets and enforcement of security Interest Act, 2002 read with provision to Rule 8(6) of the security Interest (Enforcement) Rules, 2002. Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described Immovable Property Mortgage/charged to the secured creditor, the Symbolic Possession of which has been taken by the authorized officer of Indian Bank CBD BELAPUR Branch, Secured Creditor, will be sold on "As is where is", "As is what is" and "Whatever there is" on 12.08.2022 for recovery of Rs.51,55,042/- (Rupees Fifty One Lakhs Fifty Five Thousand Fourty Two Only) as on 20.11.2021) due to the Indian Bank, CBD BELAPUR Branch, Secured creditor, from 1. M/s. G. S. Engineering 2. Mr. Satish Vilas Thorve and 3. Mrs. Shubhangi Satish Thorve (Borrowers & Borrowers). The Specific details of the Property intended to be brought to sale through e-auction mode are enumerated below:

Property No.	Detailed description of the Property	DATE AND TIME OF E-AUCTION: 12.08.2022, 2.00 pm to 5.00 pm		Property ID No.
		Reserve Price (IN ₹)	EMD Amount (IN ₹)	
1.	Flat No. 1104, 11 th Floor, Excellence tower, Plot No. 17, Sector 17 Village Kalamboi, Tal. - Panvel, Dist.- Raigad, admeasuring carpet area of 510 Sq. Ft.	₹ 55,000,000.00	₹ 5,50,000.00	IDB000C074-T
		₹ 10,000.00		

Encumbrances on the Property: Nil

Bidders are advised to visit the website (www.msctcecommerce.com) of our e-auction service provider **MSTC Ltd.** to participate in online bid. For Technical Assistance please call **MSTC HELPDESK No. 033-22901004** and other helpline numbers available in service providers help desk. For registration status with **MSTC Ltd.**, Please contact ibapiop@msctcecommerce.com and for EMD status please contact ibapifin@msctcecommerce.com. For Property details and photograph of the property and auction terms and conditions please visit <https://ibapi.in> and for clarifications related to this portal, Please contact help line number 18001025026 and 011-41106131. Bidders are advised to use Property ID number mentioned above while searching for the property in the website with <https://ibapi.in> and www.msctcecommerce.com.
Date : 25.07.2022
Place: Mumbai
Authorised Officer, Indian Bank

JASH ENGINEERING LIMITED

CIN: L28910MP1973PLC001226
Registered Address: 31, Sector-C, Sanwer Road, Industrial Area, Indore 452015, Madhya Pradesh, India
Phone:- 0731-6732700 Email:- info@jashindia.com, Website:- www.jashindia.com

NOTICE

Notice is hereby given that, pursuant to the provisions of the Companies Act, 2013 and the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, equity shares of those Members who have not encashed or claimed dividend for 7 (seven) consecutive years or more are liable to be transferred to the Investor Education and Protection Fund ("IEPF"). In compliance with the said Rules, the Company has sent individual notice to all concerned Member whose shares are liable to be transferred to IEPF. Full details of such Members are made available on the Company's website at www.jashindia.com.

In this connection, concerned Members may please note the following:-

(a) For Members holding shares in physical form: Members whose shares are liable to be transferred to IEPF Authority may note that upon transfer of shares to IEPF Authority, the original share certificate(s) which are registered in their name will stand automatically cancelled and be deemed non-negotiable.

(b) For Members holding shares in electronic form: Their demat account will be debited for the shares liable for transfer to IEPF.

In order to avoid transfer of your shares to the IEPF, any Member whose name is appearing in the above-mentioned list shall send an application along with self-attested copy of KYC documents of the Member like PAN, cancelled cheque leaf along with latest utility bill as address proof, on or before 24th October, 2022 to Jash Engineering Limited ("Company") at 31, Sector-C, Sanwer Road, Industrial Area, Indore, Madhya Pradesh- 452015 or Link Intime India Private Limited ("RTA") at C-101, 1st Floor, 247 Park, Lal Bahadur Shastri Marg, Vikhroli (West) Mumbai, Maharashtra- 400083. For any further information regarding members may send email at rtm.helpdesk@linkintime.co.in. In case no valid claim in respect of equity shares is received from Members by 24th October, 2022, the Company shall, in compliance with the requirements set out in the said Rules, transfer the unclaimed dividend and corresponding equity shares to the IEPF by the due date, without any further notice. Please note that no claim shall lie against the Company in respect of the unclaimed dividend amount and equity shares transferred to the IEPF.

In order to receive the correspondence, if any, from the Company in a timely manner, Members are requested to registered their e-mail address with RTA (in case of shares held in physical form) by sending a request on rtm.helpdesk@linkintime.co.in and your Depository Participant(s) (in case of shares held in dematerialized form).

For Jash Engineering Limited
Sd/-
Tushar Kharpada
Company Secretary & Compliance Officer

Place: Indore
Date: 26/07/2022

AETHER INDUSTRIES LIMITED

www.aether.co.in

STATEMENT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2022 (Rupees in million except as stated)

Sl. No.	Particulars	30.06.2022	31.03.2022	30.06.2021	31.03.2021
1	Total Income from Operations	1661.70	1477.06	1511.97	5970.21
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	412.24	351.62	404.18	1464.73
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and / or Extraordinary items)	412.24	351.62	404.18	1464.73
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and / or Extraordinary items)	306.20	260.23	323.27	1089.29
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	303.49	260.17	323.74	1087.81
6	Paid-up Equity Share Capital (Face Value of Rs. 10 each)	1244.83	1126.91	100.99	1126.91
7	Earnings per Equity Share (Rs.)				
	Basic	2.46	2.31	3.34	9.67
	Diluted	2.46	2.31	3.34	9.67

Note:
1 The above unaudited Financial Results have been reviewed by the Audit Committee and thereafter approved and taken on record by the Board of Directors in their respective Meetings held on July 25, 2022. The above financial results of the Company are prepared in accordance with the Indian Accounting Standards (referred to as 'IndAS') as prescribed under Section 133 of the Companies Act, 2013 read with Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended from time to time.
2 The 'Limited Review' of the unaudited Financial Results for the Quarter ended on June 30, 2022 pursuant to Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 has been carried out by the Statutory Auditors. An unmodified review report has been issued by them thereon.
3 The above is an extract of the detailed format of the Quarterly Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The aforesaid unaudited Financial Results will be uploaded on the Company's web-site www.aether.co.in and will be also available on the website of BSE Limited www.bseindia.com and National Stock Exchange of India Limited www.nseindia.com for the benefit of shareholders / investors.
4 The Equity Shares and basic / diluted earnings per share for the Comparative period (quarter ended June 30, 2021) has been presented to reflect the adjustments for issue of bonus issue as approved by shareholders on September 18, 2021 in accordance with IndAS 33 - Earning per share.

For and on behalf of the Board of Directors
Ashwin J. Desai
Managing Director
DIN:00038386
CONCEPT

Place: Surat
Date : July 25, 2022

Bank account becomes inoperative if there is no transaction in the account for more than two years.

Visit your bank branch or its website to revive your inoperative bank account.

For more details, give a missed call to 14440 or visit <https://rbikehtahai.rbi.org.in/ud>
For feedback, write to rbikehtahai@rbi.org.in

*Terms and conditions apply

Issued in public interest by
भारतीय रिजर्व बैंक
RESERVE BANK OF INDIA
www.rbi.org.in